



B. A. (Sem. II) (CBCS) Examination

April / May – 2015

**MEN AND ENVIRONMENT SYSTEM
(Part - 4) (Core)**

Faculty Code : 001

Subject Code : 001230

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

સૂચના : (1) દરેક વિભાગના પ્રશ્નોના પુરા જવાબ મુખ્ય ઉત્તરવહીમાં આપવાના રહેશે.
(2) જરૂર હોય ત્યા સ્વચ્છ આકૃતિ/નકશા દોરો.

વિભાગ - I

1 બહુવિકલ્પીય પ્રશ્નો (MCQ) : 20

- (1) 5th જૂન ક્યા દિવસ તરીકે ઉજવાય છે.
(A) વિશ્વ પર્યાવરણ દિવસ (B) ડાર્વિનનો જન્મ દિવસ
(C) વિશ્વ આરોગ્ય દિવસ (D) વિશ્વ વસ્તી દિવસ
- (2) ગંગા નદી મુખ્ય રૂપે ક્યા વિસ્તાર માંથી પ્રદૂષિત થાય છે.
(A) દેવ પ્રયાગ (B) કાનપુર
(C) વારાણસી (D) હરીદ્વાર
- (3) ઈકો સિસ્ટમએ મુખ્ય પાયાની બાબત છે
(A) ખોડુ (B) સાચું
(C) એક પણ નહીં (D) પવનનું નિક્ષેપ
- (4) પાણીનાનું કારણ શું છે ?
(A) એરોલેન (B) ધૂમાડો
(C) વાહનનો કચરો (D) 2, 4d અને રાસાયણિક ખાતર
- (5) ઈકો સિસ્ટમ શર્જદ કોના દ્વારા અપાયેલ છે.
(A) ઈ.પી. ઓડમ (B) એ.જી. તેન્સલે
(C) આર. એલ. લીન્ડમેન (D) એફ.આર. ફાસબર્ગ

- (6) CFC ના પ્રદૂષણનો મુખ્ય સ્તોત છે.
(A) રેઝિજરેટર અને જેટ એયરવેજ
(B) જેટ એયર કાફિટ
(C) બળતણના સાધનો અને જેટ એયર કાફિટ
(D) ઉપરોક્ત બધા જ
- (7) ચિપકો આંદોલનની શરૂઆત કંયાથી થઈ હતી.
(A) આસામ (B) રાજસ્થાન
(C) કેરલા (D) ગઢવાલ
- (8) DDT પાક ઉપર છાંટવાથી ક્યા પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે.
(A) હવાનું (B) હવા અને જમીનોનું
(C) હવા જમીન અને પાણીનું (D) હવા અને પાણીનું
- (9) સમશીતોષ્ણ સતત લીલા જંગલો ક્યાં આવેલા છે ?
(A) આસામ (B) હિમાલયની હારમાળામાં
(C) પ. ઘાટ (D) અરવલ્લીની હારમાળાઓમાં
- (10) ભારત સરકાર દ્વારા પશુ સંરક્ષણ નિયમ ક્યારે બનાવવામાં આવ્યું.
(A) 1976 (B) 1980
(C) 1972 (D) 1970
- (11) હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે.
(A) જંગલોની અધિત (B) જમીનનું ધોવાણ
(C) શ્રીન હાઉસ ઈંફેક્ટ (D) શહેરીકરણ
- (12) જંગલો ઘટવાથી ક્યા પ્રકારનું પરીવર્તન જોવા મળે છે.
(A) વરસાદ (B) જમીનની ફળદૂપતા
(C) જમીનનું ધોવાણ (D) એક પણ નહી
- (13) ક્યો દિવસ “વિશ્વ સંરક્ષણ દિવસ” તરીકે ઉજવાય છે.
(A) 7th ડિસેમ્બર (B) 3rd ડિસેમ્બર
(C) 5th ડિસેમ્બર (D) 14th ડિસેમ્બર

- (14) વિશ્વમાં પર્યાવરણની સમસ્યાઓ માટેની પ્રથમ આંતરાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યા યોજાએલ હતી.
- (A) ટોકીઓ (B) પેરીસ
(C) સ્ટાકહોમ (D) લંડન
- (15) “ચિપકો આંદોલન” કોની સાથે જોડાયેલું છે.
- (A) અવાજનું પ્રદૂષણ (B) જમીનોનું પ્રદૂષણ
(C) જંગલોનું સંરક્ષણ (D) ઉપરોક્ત એક પણ નહીં
- (16) વાતાવરણમાં પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે.
- (A) CO_2 (B) CO
(C) CO_3 (D) N
- (17) કઈ વનસ્પતિ ખડકોમાં ઉત્પન્ન થાય છે.
- (A) સાઈકોફાઈટ (B) લીથોફાઈટ
(C) આક્સીલોફાઈટ (D) હેલોફાઈટ
- (18) અભ્યાઈન વનસ્પતિની કઈ ઊંચાઈએ મળી આવે છે.
- (A) 1000-1500 m (B) 1900-3000 m
(C) 500-1000 m (D) 3900-6000 m
- (19) નીચેનામાંથી ક્યા વિસ્તારમાં બાયોડાઈર્વસીટી વધુ જોવા મળે છે.
- (A) વિશુવવૃતીય પ્રદેશ (B) માનસુન પ્રદેશ
(C) ધ્રુવીય પ્રદેશ (D) ઉપરોક્ત એક પણ નહીં
- (20) WWF અર્થात શું છે.
- (A) વેસ્ટ વાટર ફંડ (B) વર્ક વાઈડ લાઈફ ફંડ
(C) વર્ક વાઈડ ફંડ (D) વાઈલ વર્ક ફંડ

વિભાગ - II

- 2** માનવ પર્યાવરણ વચ્ચેના સંબંધ સમજાવી પારીસ્થિતિકીય વિજ્ઞાન અને પારીસ્થિતીકીય તંત્રનો ઘ્યાલ આપો. **10**

અથવા

- 2** એતિહાસિક પરીપેક્ષમાં માનવ અને પર્યાવરણ સંબંધોની ચર્ચા કરો. **10**

- 3** પારિસ્થિતિકીય વિજ્ઞાનની વ્યાખ્યા આપો તથા પારિસ્થિતિકીય વિજ્ઞાનનું વર્ગીકરણ કરો. **10**

અથવા

- 3** પ્રદુષણ એટલે શું ? પાણીનું પ્રદુષણના જુદા જુદા સોતો ક્યા ક્યા છે ? **10**

- 4** (અ) ટૂંકનોંધ લખો : (કોઈપણ ઓક)
- 8**

(1) માનવ અને પર્યાવરણ તંત્રનું વિષય વસ્તુની ચર્ચા કરો.

(2) મૃદાવરણીય પર્યાવરણ

- 4** (બ) ટૂંકનોંધ લખો : (કોઈપણ ઓક)
- 8**

(1) પર્યાવરણની માનવ ઉપર અસર

(2) પ્રદુષણ-સંરક્ષણ અને તેનું આયોજન

- 5** ટૂંકા જવાબ આપો : (ગમે તે બે)
- 14**

(1) માનવ અને પર્યાવરણના અભ્યાસનું મહત્વ શું છે ?

(2) ઈક્રોલોજીના કાર્ય ક્ષેત્રની અવસ્થાઓ શું છે ?

(3) જીવ આવરણના ઘટકો ક્યા છે ?

(4) પર્યાવરણની સતુલન વિષે શું જાણો છો.

ENGLISH VERSION

Instructions : (i) Q.1 M.C.Q. each carries one mark.
(ii) Q.2 and Q.3 both are 15 marks
(iii) Q.4 is 5 marks

SECTION - I

- | | | |
|----------|----------------------------------|-----------|
| 1 | Multiple Choice Question. | 20 |
|----------|----------------------------------|-----------|
- (1) Which of the following day is celebrated on 5th June ?
(A) World Environment Day
(B) Darwin's Birthday
(C) World Health Day
(D) World Population Day
- (2) Where does Ganga become most pollute during flows ?
(A) Daye Prayag (B) Kanpur
(C) Varanasi (D) Haridwar
- (3) The ecosystem is the basic functional unit of ecology
(A) False (B) True
(C) None of above (D) Wind blow
- (4) Water pollution is caused by
(A) Aeroplane
(B) Smoke
(C) Automobile exhaust
(D) 2,4d and chemical fertilizer
- (5) The term ecosystem was evolutes by
(A) E.P. Odem (B) A.G. Tansley
(C) R.L. Lindmen (D) F.R. Fesberg
- (6) What does CFC pollution source includes ?
(A) Refrigerator and jet Aircraft
(B) Jet Aircraft only
(C) Fire Extinguishers and Jet Aircraft
(D) All of these

- (7) Where is the Chipko movement started ?
(A) Assam (B) Rajasthan
(C) Kerala (D) Garwal
- (8) Which of the pollution is produced by spraying of DDT on crop ?
(A) Air only (B) Air and Soil
(C) Air, Soil and Water (D) Air and Water
- (9) Where was the temperate evergreen forest found ?
(A) Assam (B) Himalayan ranges
(C) Western Ghats (D) Aravali range
- (10) When was the Wildlife Protection Act passed by the Government of India ?
(A) 1976 (B) 1980
(C) 1972 (D) 1970
- (11) What is the main cause of air pollution ?
(A) Deforestation (B) Soil erosion
(C) Green house effect (D) Urbanisation
- (12) Which of the following change is reduced by deforestation ?
(A) Rain (B) Soil fertility
(C) Soil erosion (D) None
- (13) Which one of the following day is celebrated as "World Conservation Day" ?
(A) 7th December (B) 3rd December
(C) 5th December (D) 14th December
- (14) Where was the first International Conference for Globalization for Environment problems held at ?
(A) Tokyo (B) Paris
(C) Stockhome (D) London
- (15) "Chipko movement" is related with
(A) Noise Pollution (B) Soil Pollution
(C) Forest Conservation (D) None of above

- (16) The main reason behind pollution in environment is
 (A) CO₂ (B) CO
 (C) CO₃ (D) N
- (17) Which of the following plants grow in rocks ?
 (A) Siccophytes (B) Lithophytes
 (C) Oxylophytes (D) Halophytes
- (18) Alpine forest occur at altitude of ?
 (A) 1000-1500 m (B) 1900-3000 m
 (C) 500-1000 m (D) 3900-6000 m
- (19) In which of the following highest biodiversities is found ?
 (A) Equatorial Region (B) Monsoon Region
 (C) Polar Region (D) None of above
- (20) WWF stands for ?
 (A) Waste Water Fund (B) World Wildlife Fund
 (C) World Wild Fund (D) Wild World Fund

SECTION - II

2 Explain men environment relationship and give an idea about ecology and ecosystem. **10**

OR

2 Discuss the men environment relationship on the basis of historical perspective. **10**

3 What is ecology ? Give the classification of ecosystem. **10**

OR

3 What is pollution ? What are the different sources of water pollution ? **10**

- 4 (a) Short notes : (any **one**) 8
- (i) Subject matter of Men and Environmental system
 - (ii) Lithospheric environment
- (b) Short notes : (any **one**) 8
- (i) Impact of Environment on men
 - (ii) Pollution–Conservation and planning
- 5 Write short answer : (any **two**) 14
- (i) What is the importance of men and environmental study ?
 - (ii) What are the approaches of ecology and its subject matter ?
 - (iii) What are the factors of Biosphere ?
 - (iv) What do you understand by environmental balance ?
-